

ત્વરિત જાહેરાત માટે

## આપણું શહેર બ્રેમ્પટનમાં એર કેનેડા ફ્લાઈટ 621 દુર્ઘટનાની 50<sup>મી</sup> સ્મરણતિથિ મનાવશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 25, 2020) – રવિવાર, જુલાઈ 5 નાં રોજ સવારે 11 વાગ્યે, સીટી ઓફ બ્રેમ્પટન દ્વારા ઈસ્ટ બ્રેમ્પટનમાં એર કેનેડા ફ્લાઈટ 621 ની ક્રુણ દુર્ઘટનાની 50મી સ્મરણતિથિ મનાવવામાં આવશે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને એક ઓનલાઈન વીડિયો સમારોહમાં યાદ કરવામાં આવશે અને સીટી ઓફ બ્રેમ્પટનની તમામ સગવડોમાં ધ્વજઓ અડધી નમેલી રહેશે.

આ સમારોહ ઓનલાઈન વેબસાઈટ [www.brampton.ca/bramptonremembers](http://www.brampton.ca/bramptonremembers), પર અને YouTube, Twitter અને Facebook પર @CityBrampton થી ઉપલબ્ધ થશે.

આપણો સમુદાય સંદેશાઓ, સ્મરણો અને શોક સંદેશાઓ ઓનલાઈન ગેસ્ટબુકમાં વેબસાઈટ [www.brampton.ca/bramptonremembers](http://www.brampton.ca/bramptonremembers) પર જણાવી શકે છે.

### પર્પલ લિલાક મેમોરિયલ પાર્ક

દુર્ઘટના થઈ ત્યારથી 50 વર્ષને ચિહ્નિત કરવા અને ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા, પર્પલ લિલાક પાર્કનું નામ બદલીને પર્પલ લિલાક મેમોરિયલ પાર્ક કરવામાં આવ્યું છે, આ પાર્ક દુર્ઘટના સ્થળે, 72 ડિગ્રે ડ્રાઈવ પર સ્થિત છે. પાર્કમાંના સ્મારક સ્થળ પર લિલાક વૃક્ષો ખીલેલા છે, જ્યાં માર્ગ પરના 109 ગ્રેનાઈટ પથ્થરો દરેક ભોગ બનેલી વ્યક્તિના માનમાં બેસાડેલા છે. વિશાળકાય ગ્રેનાઈટના પહાડ પરની તક્તી પર ભોગ બનેલા લોકોના નામોની યાદી જોઈ શકાય છે.

આપણું શહેર ઓન્ટેરિયો હેરિટેજ એક્ટ હેઠળ આ પાર્કને સાંસ્કૃતિક વારસો સંસાધન તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયામાં છે.

### બેકગ્રાઉન્ડ (પશ્ચાદભૂ)

જુલાઈ 5, 1970 નાં રોજ, એર કેનેડા ફ્લાઈટ 621, એક ડગ્લાસ DC-8 વિમાન, તે સમયના કેસલમોર ગામના ખેતરોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, કેસલમોર હવે કેસલમોર રોડ અને મેકવીન ડ્રાઈવ તરીકે ઓળખાય છે. તે વિમાન મોન્ટ્રીયલથી લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક જવાના માર્ગમાં, નિર્ધારિત ટૂંકા ગાળાના વિરામ માટે ટોરોન્ટો આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

ફ્લાઈટ પરના તમામ 109 લોકો, જેમાં 100 ઉતારુઓ અને નવ ચાલક દળના સભ્યો હતા, મૃત્યુ પામ્યા હતા. દુર્ઘટના સમયે, એર કેનેડા ફ્લાઈટ 621 કેનેડાના ઈતિહાસમાં બીજી સૌથી જીવલેણ વિમાન દુર્ઘટના હતી. તે દુનિયાભરમાં કેનેડિયન નાગરિકોને સમાવતી સૌથી ખરાબ વિમાન દુર્ઘટનાઓમાંની એક રહી છે. ભોગ બનેલા લોકોમાં મોન્ટ્રીયલ અને વાનકુવરના કેનેડિયનો, અને અમેરિકન નાગરિકોનો સમાવેશ થતો હતો. ફ્લાઈટ 621 નાં ઓગણપચાસ ઓળખી કાઢેલા અને ત્રણ અજાણ્યા ભોગ બનેલા લોકોને ટોરોન્ટોમાં માઉન્ટ પ્લેઝન્ટ સેમિટરીમાં દફનાવવામાં આવ્યા હતા. તે દુર્ઘટનાનો ભોગ બનેલા બધાં લોકોની લાશો મેળવી શકાઈ ન હતી.

એર કેનેડા ફ્લાઈટ 621 દુર્ઘટના અને શહેરની સ્મરણાંજલિ વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca/bramptonremembers](http://www.brampton.ca/bramptonremembers).

**અવતરણો (ક્વોટ્સ):**

“પચાસ વર્ષો પહેલાં, એર કેનેડા ફ્લાઈટ 621 બ્રેમ્પટનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેણે ઘણાં લોકોનું જીવન બદલી નાખ્યું હતું. આ દુઃખદાયી યાદ બ્રેમ્પટનના ઇતિહાસનો એક નોંધપાત્ર ભાગ છે. હાલમાં COVID-19 ને લીધે વ્યક્તિઓ વચ્ચે કડક શારીરિક અંતર જાળવવાના ઉપાયો અમલમાં લેવાને લીધે, અમે પર્યાવરણ લિલાક મેમોરિયલ પાર્કમાં સ્મરણાંજલિ સમારોહ રૂબરૂમાં યોજી શકતા નથી. હું કહું છું કે તમે આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના માનમાં જુલાઈ 5 નાં રોજ ઓનલાઈન સ્મરણાંજલિ સમારોહ માટે અમારી સાથે જોડાશો.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“એર કેનેડા ફ્લાઈટ 621 દુર્ઘટના એક કરુણ દુર્ઘટના હતી જેને બ્રેમ્પટન ક્યારેય ભૂલશે નહીં. અમે જીવ ગુમાવનાર લોકો અને તેનાથી અસરગ્રસ્ત તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાના છીએ ત્યારે જુલાઈ 5 નાં રોજ અમારી સાથે ઓનલાઈન સમારોહમાં જોડાશો. હું તમને તમે પોને અથવા તમારા કુટુંબીજનો સાથે પર્યાવરણ લિલાક મેમોરિયલ પાર્કની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; સીટી ઓફ બ્રેમ્પટન

“દુઃખદ એર કેનેડા ફ્લાઈટ 621 દુર્ઘટનાગ્રસ્ત થઈ ત્યારથી 50 વર્ષો વિતી ગયા છે, અને બ્રેમ્પટનને તે હજી પણ યાદ છે. આપણે આ પ્રસંગે રૂબરૂમાં સ્મરણાંજલિ પાઠવી શકતા નથી ત્યારે, પર્યાવરણ લિલાક મેમોરિયલ પાર્ક ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતું એક સુંદર સ્થળ છે. કૃપા કરી જુલાઈ 5 નાં રોજ વેબસાઈટ [www.brampton.ca/bramptonremembers](http://www.brampton.ca/bramptonremembers) પર ઔપચારિક વીડિયો સમારોહ જોશો અને ગેસ્ટબુક પર સહી કરશો.”

- ચાર્માઈન વિલિયમ્સ (Charmaine Williams), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણે એર કેનેડા ફ્લાઈટ 621 દુર્ઘટનાની 50મી સ્મરણતિથિ પ્રસંગે સ્મરણાંજલિ આપવા રૂબરૂમાં ભેગા ના થઈ શકીએ, પરંતુ આપણે આ પ્રસંગને યાદ કરીએ તે મહત્વનું છે. સીટી કર્મચારીઓએ દુર્ઘટનાને સ્મરણાંજલિ આપવા ઓનલાઈન હબ બનાવ્યું છે, જેમાં ઔપચારિક વીડિયો, એક ગેસ્ટબુક અને ઘણું સામેલ છે. ઔપચારિક વીડિયો જીવ ગુમાવનાર લોકોને, જે લોકો માટે આ કરુણ ઘટનાથી પ્રભાવિત થવાનું ચાલુ રહ્યું હોય તેવા લોકોને, પ્રથમ પ્રતિભાવ આપનાર લોકો, ઉતારુઓ અને વિમાન ચાલક દળના કુટુંબીજનો, અને તે સમયે તે વિસ્તારમાં રહેતા લોકોના માનમાં બનાવેલો છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)